

ત્વરિત જાહેરાત માટે

દસ લાખ વૃક્ષોનો કાર્યક્રમ (One Million Trees Program): 2020માં આખા બ્રેમ્પટનમાં 50,000 નવા વૃક્ષો રોપાશે

બ્રેમ્પટન, ઓન્ટારિયો (19 ફેબ્રુઆરી 2020) – આજે બ્રેમ્પટન સીટી કાઉન્સિલે દર વર્ષે દસ લાખ વૃક્ષોનો કાર્યક્રમ (One Million Trees Program) અન્વયે શહેરમાં 50,000 નવા વૃક્ષોના રોપવા અનુમોદન આપ્યું હતું. આબોહવા પરિવર્તનના ખતરાને પહોંચી વળવા માટે આ બીજું મોટું પગલું છે

2050 સુધીમાં શહેરમાં 80 ટકા જેટલા ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જન ઘટાડવાના લક્ષ્યને પહોંચી વળવા માટે 2019માં કાઉન્સિલે સર્વસંમતિથી આબોહવા કટોકટી જાહેર કરી હતી.

છેલ્લા પાંચ વર્ષમાં, સિટી અને – સંરક્ષણ અધિકારીઓ, રિજન ઓફ પીલ, શાળા મંડળો અને વિકાસશીલ ઉદ્યોગો સહિત તેમના ભાગિદારોએ – બ્રેમ્પટનમાં પ્રત્યેક વર્ષે સરેરાશ 43,000 વૃક્ષો વાવ્યા છે. વર્ષે ઓછામાં ઓછા 7,000 વૃક્ષોના વાવેતરના વધારા સાથે હવે સિટી 2040 વિઝનના લક્ષ્ય સુધી પહોંચવાની અણીએ છે જ્યારે તે 2040 સુધીમાં દસ લાખ વૃક્ષોનું લક્ષ્ય સિદ્ધ કરશે.

આબોહવા પરિવર્તનના ઘટાડા અને અનુકૂલનમાં, શહેરી વિસ્તારોમાં વન ઊભું કરવામાં અને જાહેર આરોગ્યને સમર્થન આપીને સ્થળોને વધુ સુંદર બનાવવામાં વૃક્ષોની ભૂમિકા અગત્યની છે. વન મિલિયન ટ્રીઝ પ્રોગ્રામ વધુ વૃક્ષો વાવશે, ખાસ કરીને માર્ગો પર, સાર્વજનિક ઉદ્યાનોમાં, અને હાલના રહેવાસી વિસ્તારોમાં આવેલ સિટીની માલિકીની જમીનો પર તેમજ વ્યાપારિક/ઔદ્યોગિક જમીનો પર જેથી લીલોતરી વધે અને ઈકોસિસ્ટમની સેવાઓનું પ્રદાન વધે.

સિટી સ્થિરતા અંગે પ્રતિબદ્ધ છે અને આ પ્રયાસોથી ગ્રીન સિટી ઊભું કરવામાં યોગદાન મળે છે જે ટર્મ ઓફ કાઉન્સિલની અગ્રીમતા છે.

હકિકતોનો ટૂંકસાર:

- બ્રેમ્પટનમાં હાલમાં આશરે 3.6 મિલિયન એટલેકે છત્રીસ લાખ વૃક્ષો છે જે કુલ અવરાયેલ ભૂમિના 18 ટકા થાય છે.
- વન મિલિયન ટ્રીઝ પ્રોગ્રામ ભૂમિમાં નવા વૃક્ષોને પલ્લવિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. 2040 સુધીમાં દસ લાખ વૃક્ષો હાંસલ કરવા માટે વાર્ષિક ધોરણે 7,000 વધારાના વૃક્ષો રોપવાની આવશ્યકતા રહેશે.
- ઈન્વેન્ટરીની પ્રક્રિયા, પ્રચાલન, જાળવણી અને શહેરી જંગલની દેખરેખને સિટીનો *અર્બન ફોરેસ્ટ મેનેજમેન્ટ પ્લાન* સંબોધિત કરશે, જેનો હાલમાં વિકાસ કરવામાં આવી રહ્યો છે.

અવતરણો

"બ્રમ્પટનને ગ્રીન સિટી બનાવવા તરફ આ બીજું રોમાંચક પગલું છે તેમ કહી શકાય અને સિટી આબોહવા પરિવર્તનના પડકારને જવાબ આપવા પોતાની ફરજ બરાબર બજાવી રહી છે. ગ્લોબલ કવેનન્ટ ઓફ મેયેર્સ ફોર ક્લાઈમેટ એન્ડ એનર્જીના સદસ્ય તરીકે આશા સેવું છું કે આ વર્ષે આ સાહસિક અને પડકારરૂપ વ્યુહનો અમલ થશે અને સાથે જ આના કરતા વધુ પર્યાવરણ માટે અનુકૂળ પહેલો ભવિષ્યમાં આવશે.

– પૅટ્રિક બ્રાઉન, મેયર, સીટી ઓફ બ્રમ્પટન

"2050 સુધીમાં બ્રમ્પટનમાં ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનો 80 ટકા જેટલા ઘટાડવાનું અમારું લક્ષ્ય છે જે મોટો પડકાર છે પરંતુ આપણે બધાં આપણા સમાજના ભાગિદારો અને દસ લાખ વૃક્ષોનો કાર્યક્રમ (One Million Trees Program) જેવી પહેલોથી તે હાંસલ કરી શકીશું."

- પૉલ વિસેન્ટ, રીજનલ કાઉન્સિલર વૉર્ડ 1 અને 5 અને પબ્લિક વર્ક્સ એન્ડ એન્જિનિયરિંગ, સિટી ઓફ બ્રમ્પટનના પ્રમુખ

"બ્રમ્પટન ખાતે કેટલીક આશ્ચર્યજનક હરિત જગ્યાઓ છે અને દસ લાખ વૃક્ષોનો કાર્યક્રમ (One Million Trees Program) એક રોમાંચક પહેલ છે જે ભાગીદારીઓ મારફતે આપણા સમર્પિત કર્મચારીગણને કાઉન્સિલની ગ્રીન સિટી બનાવવાની અગ્રિમતા આગળ ધપાવવાનું ચાલું રાખશે જેથી આપણાં રહેવાસીઓને માણવા માટે હજું પણ વધુ માત્રામાં વૃક્ષનું આવરણ સર્જી શકાય.

– ડેવિડ બાર્રિક, ચીફ એડમિનિસ્ટ્રેટિવ ઓફિસર (David Barrick, Chief Administrative Officer), સિટી ઓફ બ્રમ્પટન

-30-

કેનેડાના સૌથી ઝડપી વિકાસ કરતા શહેરો પૈકી એક તરીકે બ્રમ્પટનમાં 650,000 લોકો વસે છે અને તેમાં 70,000 વ્યવસાયો છે. અમે જે કંઈ કરીએ છીએ તેનો હાર્દ છે લોકો. અમને ઊર્જા મળે છે અમારા વિવિધ સમાજોમાંથી, અમે રોકાણ માટે આકર્ષણનું કેન્દ્ર છીએ અને અમે તકનિકી અને પર્યાવરણીય નવિનતા તરફ દોરી જતી યાત્રાનું નેતૃત્વ કરીએ છીએ. અમારી ભાગીદારી એવા નિરોગી શહેરના વિકાસ માટે છે જે સુરક્ષિત, ટકાઉ અને સફળ હોય. અમારી સાથે [Twitter](#), [Facebook](#), અને [Instagram](#) પર જોડાવ. અહીં વધુ જાણકારી મેળવો www.brampton.ca.

મિડિયા સંપર્ક :

મોનિકા દુગ્ગલ

કોઓર્ડિનેટર, મિડિયા એન્ડ કમ્યુનિટી એંગેજમેન્ટ

વ્યૂહાત્મક સંવાદ

સીટી ઓફ બ્રમ્પટન

905-874-3426 | Monika.Duggal@brampton.ca